



# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

93

શૈક્ષણિક વર્ષ 2024-25

ધોરણ-12 : તાત્વજ્ઞાન (136) (સામાન્ય પ્રવાહ)

વાર્ષિક પરીક્ષા

સમય : 3 કલાક

પ્રશ્નપત્રનું પરિરૂપ

કુલ ગુણ : 100

નોંધ : આ પરિરૂપ વિદ્યાર્થીઓના, શિક્ષકો, માશ્રિકો, મોડેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિપયોના પ્રાર્થિક તેમજ મોડેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણાના બુદ્ધદ્વારા દર્શાવેને રૂસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.

હેતુઓ પ્રમાણે ગુણભાર :

હેતુઓ	જ્ઞાન (K)	સમજ (U)	ઉપયોગન (A)	સંયોજન / કોશલ્ય (S)	કુલ ગુણ
ગુણ	30	28	27	15	100
ટકા (%)	30%	28%	27%	15%	100%

પ્રશ્ના પ્રકાર પ્રમાણે ગુણભાર :

ક્રમાંક	પ્રશ્નોનો પ્રકાર	પ્રકોની સંખ્યા		કુલ ગુણ
		જનરલ વિકલ્પ વગર	જનરલ વિકલ્પ સાથે	
1.	હેતુલક્ષી પ્રશ્નો (O)	20	20	20
2.	અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA)	10	10	10
3.	ટૂંક જવાબી પ્રશ્નો (SA-I)	10	14	20
4.	ટૂંક જવાબી પ્રશ્નો (SA-II)	10	14	30
5.	લાંબા પ્રશ્નો (LA)	04	06	20
	કુલ	54	64	100

પ્રકરણાંદીઠ ગુણભાર :

ક્રમ	પાઠ / પ્રકરણનું નામ	પ્રકરણાંદીઠ ગુણભાર	
		જનરલ વિકલ્પ વિના	જનરલ વિકલ્પ સાથે
1.	વિધાનના રૂપો અને તેના પ્રકારો	15	20
2.	દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય	11	-11
3.	અનુમાનના નિયમો	11	13
4.	નિરૂપાધિક સંવિધાન	11	13
5.	વ્યાપિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ	08	11
6.	ભારતીય તર્કશાસ્ક્રમાં અનુમાન	10	10
7.	મૂલ્યમાંસા	05	07
8.	ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન	08	13
9.	જગતના વિદ્યમાન ધર્મો	13	21
10.	આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ: યોગ	08	11
	કુલ ગુણ	100	130

નોંધ : જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નોના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે. ગાંય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે.



# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

શૈક્ષણિક વર્ષ 2023-24

ધોરણ-12 : તત્વજ્ઞાન (136) (સામાન્ય પ્રવાહ)

વાર્ષિક પરીક્ષા

પ્રશ્નપત્રનું માળખું

કુલ ગુણ : 100

સમય : 3 કલાક

પ્રશ્ન ક્રમ	વિભાગ તથા પ્રશ્નની વિગત	ગુણ
1 થી 20	વિભાગ-A નીચે આપેલા પ્રશ્નક્રમાંક 1 થી 20 સુધીના બહુવિકલ્પ પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ)	20
21 થી 30	વિભાગ-B નીચે આપેલા પ્રશ્નક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નોના એક-બે શરૂદોમાં જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ.	10
31 થી 44	વિભાગ-C નીચે આપેલા પ્રશ્નક્રમાંક 31 થી 44 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 10 (દસ) પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. દરેક પ્રશ્નના 2 (બે) ગુણ છે.	20
45 થી 58	વિભાગ-D નીચે આપેલા પ્રશ્નક્રમાંક 45 થી 58 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 10 (દસ) પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેક પ્રશ્નના 3 (ત્રણ) ગુણ છે.	30
59 થી 64	વિભાગ-E નીચે આપેલા પ્રશ્નક્રમાંક 59 થી 64 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 04 (ચાર) પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. દરેક પ્રશ્નના 5 (પાંચ) ગુણ છે.	20
	કુલ ગુણ	100

જોયા : કોઈપણ વિલાગમાં પાઠ્યજ્ઞનું અધ્યાત્મિક અન્યતા કોઈકની મર્જા પૃથ્વી હોય તો દુદિદીન વિદ્યાર્થીની સાચી તો પુનરના વિકલ્પમાં કોઈપણ મર્જા પૃથ્વીવાની રહેશે! અની તો માત્ર દુદિદીન વિદ્યાર્થીની સાચી રહેશે!



# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

શૈક્ષણિક વર્ષ 2023-24

## ધોરણ-12 : તત્વજ્ઞાન (136) (સામાન્ય પ્રવાહ) વાર્ષિક પરીક્ષા

સમય : 3 કલાક

નમૂનાનું પ્રશ્નપત્ર

કુલ ગુણ : 100

સૂચનાઓ :

- (1) આ પ્રશ્નપત્રમાં કુલ પાંચ (A થી E) વિભાગો છે.
- (2) પ્રશ્નની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે.
- (3) પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખો.
- (4) નવો વિભાગ નવા પાના ઉપર લખવો.

**વિભાગ - A**

- નીચે આપેલા પ્રશ્નક્રમાંક 1 થી 20 સુધીના બહુવિકલ્પ પ્રશ્નો છે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો.  
(દરેક પ્રશ્નનો 1 ગુણ) [20]
- (1) મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે ?
 

(A) એક	(B) બે	(C) ચાર	(D) પાંચ
--------	--------	---------	----------
  - (2) 'તત્વજ્ઞાન અધરો વિષય નથી' આ વિધાન ક્યા પ્રકારનું છે ?
 

(A) સાદુ	(B) સંયુક્ત	(C) શરતી	(D) જટીલ સંયુક્ત
----------	-------------	----------	------------------
  - (3) એક થી વધુ આધાર વિધાનોવાળી દલીલને ક્યા તાર્કિક કારક વડોડેવામાં આવે છે.
 

(A) કાતો.....અથવા	(B) જો.....તો.....
(C) ....અને.....	(D) જો ..... તો અને તો જ .....
  - (4) દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે ?
 

(A) એક	(B) બે	(C) ત્રણ	(D) ચાર
--------	--------	----------	---------
  - (5) MP ને લગતા નિયમ રૂપમાં ક્યા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે ?
 

(A) V	(B) &	(C) ~	(D) →
-------	-------	-------	-------
  - (6) રૂપલકી સાબિતીમાં ગ્રાંસી લીટીની આગળ લખવામાં આવતો 'P' શેનો નિર્દેશ કરે છે ?
 

(A) આધાર વિધાન	(B) ફલિત વિધાન	(C) પ્રમાણભૂતતા	(D) અપ્રમાણભૂતતા
----------------	----------------	-----------------	------------------
  - (7) સાધ્યપદ વાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય છે ?
 

(A) સાધ્ય વિધાન	(B) પક્ષ વિધાન	(C) પક્ષપદ	(D) સાધ્યપદ
-----------------	----------------	------------	-------------
  - (8) કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદેશ્ય ને સ્થાને હોય છે ?
 

(A) પહેલી	(B) બીજી	(C) ત્રીજી	(D) ચોથી
-----------	----------	------------	----------
  - (9) અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું ?
 

(A) નિગમન	(B) વ્યાપ્તિ	(C) આંશિક શરત	(D) પર્યાપ્ત શરત
-----------	--------------	---------------	------------------
  - (10) જે.એસ. મિલ ગ્રાયોગિક અન્યેખણની કેટલી શીતિઓ આપે છે ?
 

(A) પાંચ	(B) ચાલ	(C) ચાર	(D) આठ
----------	---------	---------	--------
  - (11) અનુમાન પ્રમાણ ક્યા પ્રમાણ પર આધારિત છે ?
 

(A) પ્રત્યક્ષ	(B) શરૂ	(C) અર્થોપત્ર	(D) ઉપમાન
---------------	---------	---------------	-----------



## ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

- (12) વાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વેશી વિધાનને શું કહે છે?  
(A) સ્વાર્થનુમાન (B) પરાર્થનુમાન (C) ઉપનય (D) વાપ્તિ
- (13) હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે?  
(A) વિધાયકતા (B) સર્જનાત્મકતા (C) ભાવાત્મકતા (D) અનુભવાત્મકતા
- (14) સુંદર એટલે શું?  
(A) આકર્ષક (B) મોહક (C) આનંદદાયક (D) મનોરંજક
- (15) કોના મતે 'જે ધર્મને તર્ક વહે સમજણમાં ગોઠવે તે જ ગેને સમજે છે બીજો નાદિ'?  
(A) ભનુસ્મૃતિ (B) ગાંધીજી (C) મહારિંગે વાસ (D) વિનોભાળ
- (16) ઈન્ડિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું?  
(A) જ્ઞાન (B) નીતિ (C) વૈરાગ્ય (D) ભક્તિ
- (17) 'ન્યાય ભાવના' એ ક્યા ધર્મનો નેતૃત્વ સિદ્ધાંત છે?  
(A) યહૂદી ધર્મ (B) શ્રીખિંદ્રધર્મ (C) ઝૈન ધર્મ (D) ઈસ્લામ ધર્મ
- (18) ઇન્દ્ર ધર્મનો ઉદ્ભવ કયાં થયો છે?  
(A) ભારત (B) ચીન (C) જાપાન (D) પશ્ચિમ એશિયા
- (19) સ્ત્રીયક આહારથી ચિત્ત કેવું બને છે?  
(A) અસંતુલિત (B) આવેગિક (C) સંતુલિત (D) ચંચળ
- (20) અણાંગ યોગના બહિરંગો કેટલા છે?  
(A) એક (B) ત્રણ (C) ચાર (D) પાંચ

### વિભાગ - B

- નીચે આપેલા પ્રશ્નક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નોના એક-બે શઢોમાં જવાબ લખો:  
(દરેક પ્રશ્નનો 1 ગુણ)
- (21) તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે?
- (22) જેંદલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા મકારની હોય છે?
- (23) 'HS' ના નિયમનું નામ લખો.
- (24) સંવિધાનના શક્ય લેટો કેટલા છે?
- (25) વ્યાતિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા કઈ છે?
- (26) કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન કિયાનો આરંભ થાય છે?
- (27) વાપરવાથી વધે શેવું ધન કર્યું છે?
- (28) 'માનવધર્મ' પુસ્તકના રચયિતા કોણ છે?
- (29) સર્વધર્મ સમભાવથી શું પ્રગટ થાય છે?
- (30) આંતરરાષ્ટ્રીય યોગ દ્વારા ઉજવવામાં આવે છે?

[10]



# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

(5)

## વિભાગ - C

- o નીચે આપેલા પ્રશ્નકમાંક 31 થી 44 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 10 (દસ) પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. [20]
   
(દરેક પ્રશ્નના 2 ગુણ)
- (31) '↔' નું સત્યતા કોઈક રૂપો. જાથી વા '↔' નું લક્ષ્ણ કણાયો. (ટીન્ટ હીન દિ. આ. ૧૨)
- (32) 'જો વિદ્યાર્થી મહેનત કરશે નહિ તો તેને સફળતા મળશે નહિ.' આ સંયુક્ત વિધાનની પ્રાતીક રજૂઆત કરી તેનો પ્રકાર જણાવો.
- (33) વૈકળ્પિક સંવિધાનને લગત નિયમનું રૂપ અને સંક્ષેપ લખો.
- (34) 'CD' ના નિયમનું નામ અને રૂપ લખો.
- (35) માન્યરૂપ વાળા સંવિધાનના 'હાધાધા' ભેદનું અર્થધટન લખો.
- (36) નીચેના સંવિધાનનાં આકૃતિ અને ભેદ જણાવો.
  - સર્વ વકીલો વાચાળ છે.
  - કેટલાક વકીલો વિદ્યાનાં છે.
 ∴ કેટલાક વિદ્યાનાં વાચાળ છે.
- (37) વૈજ્ઞાનિક વાપ્સિના ક્યાં તાત્ત્વિક આધારોને સ્વીકારે છે?
- (38) અનુમાન ડિયાની અનિવાર્ય શરતો કઈ છે?
- (39) સામાજિક મૂલ્યોના ઉદાહરણ આપો.
- (40) ઉત્પાદક મૂલ્યનું લક્ષ્ણ અને ઉદાહરણ લખો.
- (41) ધૂ ધૂતુનો અર્થ લખો.
- (42) ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે?
- (43) ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલાં છે? ક્યા ક્યા?
- (44) અસ્ટ્રોંગ યોગના આઠ અંગો ક્યા ક્યા છે?

## વિભાગ - D

- o નીચે આપેલા પ્રશ્નકમાંક 45 થી 58 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 10 (દસ) પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. [30]
   
(દરેક પ્રશ્નના 3 ગુણ)
- (45) સત્યતા કોઈકની રીતનો ઉપયોગ કરી વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો. જાથીના, રદ્દોદાદકી ઝાણી જાપાન  
o ~P → (P V q) (ટીન્ટ હીન દિ. આ. ૧૨)
- (46) સત્યતા કોઈકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. (ટીન્ટ હીન દિ. આ. ૧૨)
- o A → B  
∴ B → A
- દલીલ આટેનું ઝે કોઈ શુદ્ધ?  
દલીલ આટેલા કોઈ શુદ્ધ ઝેણું ઉદ્દેશ લખો  
(ટીન્ટ હીન દિ. આ. ૧૨)



# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

(47) નીચેની રૂપલક્ષી સાભિતીમાં ખાલી જગ્યા પૂરો.

1.  $(J \rightarrow K) \& (L \rightarrow M)$  P
2. J & L  $\therefore K \& M$
3.  $J \rightarrow K$  \_\_\_\_\_
4. J \_\_\_\_\_
5. K \_\_\_\_\_
6.  $L \rightarrow M$  \_\_\_\_\_
7. L \_\_\_\_\_
8. M \_\_\_\_\_
9.  $K \& M$  \_\_\_\_\_

(48) નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાભિતીની રચના કરો.

- $H \rightarrow (I \& J)$   
 $(I \vee G) \rightarrow K$   
H

$\therefore K \& I$

✓ (49) નીચેના સંવિધાનની આકૃતિ અને બેદ દર્શાવી તેમના પ્રામાણ્યની તપાસ કરો.

- સર્વ વ્યસનીઓ નિર્બંધ છે.
- સર્વ નિર્બંધ રોગિએ છે.

$\therefore$  કેટલાક રોગિએ વ્યસનીઓ છે.

✓ (50) નીચેના સંવિધાનની આકૃતિ અને બેદ દર્શાવી તેમના પ્રામાણ્યની તપાસ કરો.

- સર્વ ફળો તાજી હોય છે.
- સર્વ ફૂલો તાજી હોય છે.

$\therefore$  સર્વ ફૂલો ફળો છે.

(51) વ્યાપિકરણની પ્રક્રિયાના તાત્ત્વિક આધારો સમજાવો.

(52) ટૂંકનોંખ લખો : સાઢી ગણના મૂલક વ્યાપિની મર્યાદા.

(53) વિજ્ઞાનયુગમાં ધર્મનું મહત્વ સમજાવો.

(54) ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો.

(55) જૈન, બૌધ્ધ અને હિન્દુ ધર્મના ધર્મગ્રંથો (શાસ્ત્રો)ના નામ લખો.

(56) પ્રિસ્ટી, ઠસ્લામ અને શિન્નો ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો.

(57) પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો.

(58) સત્યવાક્યના ગુણો વિશે ટૂંકનોંખ લખો.

## વિભાગ - E

• નીચે આપેલા પ્રશ્નક્રમાંક 59 થી 64 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 04 (ચાર) પ્રશ્નોના સંવિધાનાર્થ જવાબ લખો. [20]

(દરેક પ્રશ્નાનું 5 ગુણ)

નિયમાદિતી, સાંદર્ભીયાદિતી ત્રયાની સાગુજી

✓ (59) 'ઓન્નું તાર્કિક સ્વરૂપ સત્યતાકોષકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ આપો.

દરેક પ્રશ્નાનું 5 ગુણ

✓ (60) 'ઓન્નું તાર્કિક સ્વરૂપ સત્યતાકોષકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ આપો.

દરેક પ્રશ્નાનું 5 ગુણ

નિયમાદિતી, સાંદર્ભીયાદિતી ત્રયાની પરિવહન વર્ણનો

[4] લોદી અભિજાળબો

(દરેક પ્રશ્નાનું 5 ગુણ)

(61) નીચેની દલીલની પ્રાતીક રજૂઆત કરી અને સત્યતા કોઈકની પ્રત્યક્ષ શીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરો.

- જો આ પર્વત ધુમ્રસ્થાન છે તો આ પર્વત અભિસ્થાન છે. **અધ્યાત્મ દર્શન બાળ શાલુણાલ દર્શન એવી કોઈ હું?**

આ પર્વત અભિસ્થાન નથી.

∴ તેથી, આ પર્વત ધુમ્રસ્થાન નથી.

(62) અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો.

(63) જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ લખો.

(64) આચરવા ધોરણ સદગુણો અને ટાળવા ધોરણ દુર્ગુણો ક્યા છે?

• • •